

ત્વરિત જાહેરાત માટે

ટૂંક સમયમાં થનાર પ્રસંગોમાં ઉજવીએ બ્રેમ્પટનનું વૈવિધ્ય

શીખ ધરોહર માસ (Sikh Heritage Month) અને શહેરનું સૌ પ્રથમ કમ્યુનિટી ઈફ્ટાર માટે અમારી સાથે જોડાવ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (25 એપ્રિલ 2019) – સીટી ઓફ બ્રેમ્પટન આવતા કેટલાક સપ્તાહમાં બે પ્રસંગો મારફત ઉજવશે પોતાનું સાંસ્કૃતિક વૈવિધ્ય. તમામ નાગરિકોને એપ્રિલ 27ના રોજ શીખ સમાજની વધામણી કરવા અને સીટીના પ્રથમ કમ્યુનિટી ઈફ્ટાર માટે મે 16ના રોજ હાજર રહેવા આમંત્રિત કરવામાં આવે છે.

શીખ ધરોહર માસ

સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા એપ્રિલ મહિનાને બ્રેમ્પટન ખાતે તેમજ આખા દેશમાં શીખ કેનેડિયનોના મહત્વપૂર્ણ યોગદાનોને વધાવી લેવા માટે એપ્રિલ મહિનાને શીખ ધરોહર માસ તરીકે જાહેર કર્યો છે. એપ્રિલ 27ના રોજ સાંજે 5:30 વાગ્યે સીટી હોલ એટ્રિયમ ખાતે પરંપરાગત ક્યુઝિનનો સ્વાદ માણવા, નેટવર્ક કરવા અને હળવામળવા તેમજ પ્રેરણાદાયક વક્તાઓને સાંભળવા માટે જરૂરથી પધારશો. ઉત્તરાર્ધમાં શીખ હેરિટેજ મન્ય ફાઉન્ડેશનનો સમાપન પ્રસંગ યોજાશે જેમાં હશે જીવંત મનોરંજન, સાંસ્કૃતિક માહિતી, આર્ટિસ્ટ માર્કેટપ્લેસ અને બીજું ઘણું બધું.

કમ્યુનિટી ઈફ્ટાર

રમઝાન મુબારક! ગાર્ડન સ્ક્વેર ખાતે મે 16ના રોજ સાંજે 7 વાગ્યે સીટી ઓફ બ્રેમ્પટનના યજમાનપદે પ્રથમ કમ્યુનિટી ઈફ્ટારનું આયોજન થશે. આ પ્રસંગ સૂર્યોસ્ત સમયે નિશુલ્ક સાર્વજનિક જમણથી પવિત્ર રમઝાન માસને બિરદાવશે જ્યારે મુસલમાન બિરાદરો પોતાનો રોજો છોડી શકશે. રૂહાની સ્ટેજ કાર્યક્રમ, સાંસ્કૃતિક ડિસ્પ્લેને માણવા બધાં લોકોનું સ્વાગત છે, જેના બાદ દુવા મંગાશે અને પરંપરાગત ભોજન હશે.

સંખ્યા મર્યાદિત છે તેથી કૃપા કરીને RSVP, મે 12 સુધીમાં www.brampton.ca/events પર આપી દેશો.

આ પ્રસંગો બ્રેમ્પટનનાં કમ્યુનિટી રેકગનિશન પ્રોગ્રામનો ભાગ છે, જે સાંસ્કૃતિક ઉજવણીઓની શ્રેણી છે જે સીટી દ્વારા આખા વર્ષ દરમિયાન બ્રેમ્પટનના વૈવિધ્યને બિરદાવવા માટે યોજવામાં આવે છે. આ પ્રસંગોનું માધ્યમ નાગરિકોને બીજી સંકૃતિઓ વિશે જાણકારી મેળવવાની જબરદસ્ત તક પૂરી પાડે છે તેમજ આપણું શહેર સમાવી લે છે એવા ઘણા બધાં સમાજોને જાણવા ઓળખવાનો અવસર ઊભો કરે છે.

આવા અવસરો અને અન્ય સીટી ઈવેન્ટ્સ વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca/events.

ક્વોટ

"કાઉન્સિલ વતી અમે સહુ ગૌરવ અનુભવીએ છીએ કે સીટી આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી મારફત બ્રમ્પટનના અદ્ભૂત વૈવિધ્યને ઉજવી રહ્યું છે. અમને આશા છે કે તમામ સાંસ્કૃતિક પૃષ્ઠભૂ ધરાવતા નિવાસીઓ અમારી સાથે એપ્રિલ 27ના રોજ શીખ સમાજની ગૌરવશાળી ધરોહરને સમજવા માટે જોડાશે તેમજ સાર્વજનિક ઇફતારમાં મે 16ના રોજ અમારી સાથે ભોજન લેશે.

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

સીટી ઓફ બ્રમ્પટન વિશે વિષે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca અમને ફોલો કરો [Twitter](https://twitter.com/brampton) પર, [Facebook](https://www.facebook.com/brampton) પર, અને [Instagram](https://www.instagram.com/brampton) પર.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca